

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ

બ્લોક નં. ૧૧, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૫૫૯ Email: mdgbcde14@gmail.com

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વ્યક્તિઓ માટે વ્યાજ સહાય યોજના.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગરની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિના અરજદારોએ દેશ/વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે, સ્વરોજગાર/ઘંઘા માટે તેમજ પરીવહન અર્થે ખરીદેલ વાહન માટે, બેન્ક મારફતે લીધેલ લોન ઉપર વ્યાજ સહાય/સબસીડી આપવા નીચેની વિગતે યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.

ક્રમ	યોજનાનું નામ	વ્યાજ સહાય/સબસીડી દર	લાભાર્થી દીઠ મહત્તમ વાર્ષિક સહાય (વધુમાં વધુ ત્રણ વર્ષ માટે)
૧	ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેન્ક મારફતે લીધેલ લોન પર વ્યાજ સબસીડી	૬%	રૂ.૧.૫૦ લાખ
૨	સ્વરોજગાર માટે બેન્ક મારફતે લીધેલ લોન પર વ્યાજ સબસીડી.	પુરૂષ લાભાર્થી ૬% અને મહિલા લાભાર્થી ૭%	પુરૂષ લાભાર્થી માટે રૂ.૬૦ હજાર અને મહિલા લાભાર્થી માટે રૂ.૭૦ હજાર
૩	પરીવહન માટે બેન્ક મારફતે લીધેલ લોન પર વ્યાજ સબસીડી	૬%	રૂ.૧.૨૦ લાખ

ઉક્ત યોજનાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિના અરજદારો પાસેથી તા.૨૭/૦૭/૨૦૨૬ થી લક્ષ્યાંક મુજબની અરજીઓ મળે ત્યાં સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લેવા માટે નિગમના પોર્ટલ <https://gbcdeonline.gujarat.gov.in> પરથી ઓનલાઇન અરજી કરી તેની સાથે જણાવેલ આધાર પુરાવાઓ (PDF FORMAT)માં અપલોડ કરવાનાં રહેશે. વધુ માહિતી માટે અને ઓનલાઇન અરજી કરવા જરૂર જણાય તો જે તે જીલ્લાના જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.)/જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.)ની કચેરી/ જીલ્લા મેનેજરશ્રી, વિજ્ઞાન સંલગ્ન નિગમોની ગૃપ જીલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, અથવા આ નિગમની વેબસાઇટ <https://sje.gujarat.gov.in/gbcde> પરથી યોજનાઓની પાત્રતા મેળવી લેવાની રહેશે અને અરજી કરતા પહેલાં યોજનાની વિગતો અવશ્ય વાંચી લેવા જણાવવામાં આવે છે.

યોજનાની પાત્રતાની શરતો / ધોરણો નીચે મુજબ રહેશે :

- (૧) અરજદારશ્રીએ નાણાંકીય વર્ષ:૨૦૨૫-૨૬ (એટલે કે તા. ૧/૪/૨૦૨૫)થી બેન્ક મારફતે લોન લીધેલ હોવી જોઈએ. અગાઉના વર્ષોમાં ઉક્ત યોજનાઓમાં બેન્ક મારફતે લીધેલ લોનના અરજદારો અરજી કરી શકશે નહીં.
- (૨) લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિના હોવા જોઈએ.
- (૩) લાભાર્થી ધ્વારા બેન્કમાંથી મેળવેલ લોન અંગેનો પુરાવો વ્યાજ સહાય/સબસીડી મેળવવા માટે નિગમને રજૂ કરવાનો રહેશે.
- (૪) ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસના હેતુ માટે બેન્ક મારફતે લીધેલ લોન પર રૂ. ૨૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં મહત્તમ રૂ.૧.૫૦ લાખ સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.
- (૫) સ્વરોજગાર માટે બેન્કમાંથી લીધેલ લોન પર રૂ.૧૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં પુરૂષ લાભાર્થીને ૬% લેખે મહત્તમ વાર્ષિક રૂ.૬૦ હજાર તેમજ મહિલા લાભાર્થીને ૭% લેખે મહત્તમ વાર્ષિક રૂ.૭૦ હજાર વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.
- (૬) પરીવહન અર્થે રોજગારી માટે ખરીદ કરેલ વાહન માટે રૂ.૨૦.૦૦ લાખની મર્યાદામાં લીધેલ લોન પર લાભાર્થીને મહત્તમ વાર્ષિક રૂ.૧.૨૦ લાખની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવા પાત્ર થશે.
- (૭) ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીએ ધોરણ-૧૨માં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ અને વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૧૦.૦૦ લાખ સુધીની હોવી જોઈએ.
- (૮) સ્વરોજગારલક્ષી અને પરીવહન યોજના માટે લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ. અને લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ સુધીની હોવી જોઈએ.
- (૯) પરીવહન યોજના અંતર્ગત વ્યાજ સહાય મેળવનાર લાભાર્થી ઘંઘા રોજગાર માટે ખરીદેલ વાહન પાંચ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહીં.
- (૧૦) પરીવહન યોજના અંતર્ગત બેન્ક દ્વારા મંજૂર થયેલ લોન અન્વયે ખરીદેલ વાહનની આર.સી. બુકની પ્રમાણિત નકલ નિગમને રજૂ કરવાની રહેશે.
- (૧૧) પરીવહન યોજના અંતર્ગત વાહનનું રજીસ્ટ્રેશન આર.ટી.ઓ.માં Business Purpose (Taxi, Maxi, Transport) Vehicle તરીકે કરાવવાનું રહેશે.
- (૧૨) ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અમલીત શૈક્ષણિક અને સ્વરોજગાર યોજના અથવા વ્યાજ સહાય યોજના આ બન્ને પૈકી કોઈ એક જ યોજનાનો લાભ અરજદાર મેળવી શકશે.
- (૧૩) લોનનાં હપ્તા પેટે વર્ષ દરમિયાન મુદલ અને વ્યાજની ભરેલ કુલ રકમની વિગત દર્શાવતા બેન્કના સહી સિકકાવાળા આધાર પુરાવા લાભાર્થી દ્વારા રજૂ થયેથી વ્યાજ સહાય/સબસીડી સીધી જ લાભાર્થીના બચત ખાતામાં જમા મળવાપાત્ર થશે.
- (૧૪) અરજીની તારીખે લાભાર્થીએ લીધેલ બેન્ક લોનનાં નિયમિત હપ્તા ભરવાનું ચાલુ હોવું જોઈએ.
- (૧૫) ઉક્ત યોજનાની વિગતો, સુચનાઓ અને શરતો અવશ્ય વાંચીને જ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

મેનેજીંગ ડીરેક્ટર(ઇ.ચા.)

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ

ગાંધીનગર.